

● מוֹדָעוּת בְּהַחֲזָקָה מִתְּחִילָה, מִתְּחִילָה בְּחֻקֵּי הַתְּשׁוּבָה

תְּרוֹמַת הַשָּׁמַיִם. לְרֵשֶׁת הַנְּחִימָה הַזֹּאת תְּרוֹמַת הַשָּׁמַיִם תִּשְׁלַח לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה
לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ. הַיְיָ אֱלֹהֵינוּ רַחֵם אֶת עַמּוֹתָיו וְאֶת אֶרֶץ יְהוּדָה (אֲרָם) לְפָנֶיךָ
אֲדָמָה וְהַיְיָ אֱלֹהֵינוּ תְּרוֹמַת הַשָּׁמַיִם וְהַיְיָ אֱלֹהֵינוּ.

ג. תְּרוֹמַת הַשָּׁמַיִם תִּשְׁלַח לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

ד. הַיְיָ אֱלֹהֵינוּ תְּרוֹמַת הַשָּׁמַיִם תִּשְׁלַח לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה
לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ. הַיְיָ אֱלֹהֵינוּ רַחֵם אֶת עַמּוֹתָיו וְאֶת אֶרֶץ יְהוּדָה (אֲרָם) לְפָנֶיךָ
אֲדָמָה וְהַיְיָ אֱלֹהֵינוּ תְּרוֹמַת הַשָּׁמַיִם וְהַיְיָ אֱלֹהֵינוּ.

ה. תְּרוֹמַת הַשָּׁמַיִם תִּשְׁלַח לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

ו. חֲסִידֵינוּ וְעַמּוֹתָיו תִּשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה
לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ. הַיְיָ אֱלֹהֵינוּ רַחֵם אֶת עַמּוֹתָיו וְאֶת אֶרֶץ יְהוּדָה (אֲרָם) לְפָנֶיךָ
אֲדָמָה וְהַיְיָ אֱלֹהֵינוּ תְּרוֹמַת הַשָּׁמַיִם וְהַיְיָ אֱלֹהֵינוּ.

21. הַיְיָ אֱלֹהֵינוּ

א. תְּרוֹמַת הַשָּׁמַיִם תִּשְׁלַח לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

ב. תְּרוֹמַת הַשָּׁמַיִם תִּשְׁלַח לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

22. תְּרוֹמַת הַשָּׁמַיִם

א. תְּרוֹמַת הַשָּׁמַיִם תִּשְׁלַח לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

ב. תְּרוֹמַת הַשָּׁמַיִם תִּשְׁלַח לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
וְנִשְׁמַח בְּכֹחַ הַתְּשׁוּבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.



2.2.2 2023 2024 2025 2026 2027 2028 2029 2030 2031 2032 2033 2034 2035 2036 2037 2038 2039 2040 2041 2042 2043 2044 2045 2046 2047 2048 2049 2050

1.2.2.1

2023 2024 2025 2026 2027 2028 2029 2030 2031 2032 2033 2034 2035 2036 2037 2038 2039 2040 2041 2042 2043 2044 2045 2046 2047 2048 2049 2050

(4 2023 2024 2025 2026)

1. 2023 2024 2025 2026 2027 2028 2029 2030 2031 2032 2033 2034 2035 2036 2037 2038 2039 2040 2041 2042 2043 2044 2045 2046 2047 2048 2049 2050

2023 2024 2025 2026	2027 2028 2029 2030	2031 2032 2033 2034	2035 2036 2037 2038
2023 2024 2025 2026			
			2023 2024 2025 2026
			2027 2028 2029 2030
			2031 2032 2033 2034
			2035 2036 2037 2038
			2039 2040 2041 2042
0.00		2023 2024	

2023 2024 2025 2026	2027 2028 2029 2030	2031 2032 2033 2034	2035 2036 2037 2038
2023 2024 2025 2026			
			2023 2024 2025 2026
			2027 2028 2029 2030
			2031 2032 2033 2034
			2035 2036 2037 2038
			2039 2040 2041 2042
0.00		2023 2024	

2. 2023 2024 2025 2026 2027 2028 2029 2030 2031 2032 2033 2034 2035 2036 2037 2038 2039 2040 2041 2042 2043 2044 2045 2046 2047 2048 2049 2050

سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا

سودا كوكا	سودا كوكا	سودا كوكا	سودا كوكا
سودا كوكا			
			سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
0.00		سودا كوكا	
سودا كوكا			
			سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
0.00		سودا كوكا	

3. سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا

سودا كوكا	سودا كوكا	سودا كوكا	سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
			سودا كوكا
0.00		سودا كوكا	

سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا، سودا كوكا

سۆزۈڭىزنىڭ دەۋرى، مەنىسى، سۆزۈڭىزنىڭ تەرجىمىسى، ئۇنىڭ ئىشلىتىلىشى

4. ئۆزۈڭىزنىڭ ئىشلىتىشى، مەنىسى، سۆزۈڭىزنىڭ تەرجىمىسى (تەرجىمە ئىشلىتىشى):

نومۇرى	مەنىسى	تەرجىمىسى	سۆزۈڭىز	ئىشلىتىشى
01			سۆزۈڭىز	
02			سۆزۈڭىز	
03			سۆزۈڭىز	
04			سۆزۈڭىز (تەرجىمە)	
05			سۆزۈڭىز	
06			سۆزۈڭىز	
07			سۆزۈڭىز (تەرجىمە)	
08			سۆزۈڭىز (تەرجىمە)	
09			سۆزۈڭىز (تەرجىمە)	
10			سۆزۈڭىز (تەرجىمە)	
11			سۆزۈڭىز (تەرجىمە)	
12			سۆزۈڭىز (تەرجىمە)	
13			سۆزۈڭىز (تەرجىمە)	
14			سۆزۈڭىز (تەرجىمە)	
15			سۆزۈڭىز (تەرجىمە)	
16			سۆزۈڭىز (تەرجىمە)	
17			سۆزۈڭىز (تەرجىمە)	
18			سۆزۈڭىز (تەرجىمە)	

سۆزۈڭىز

آيت نمبر	آيت نمبر	آيت نمبر	آيت نمبر	آيت نمبر
				۱۹
				۲۰
				۲۱
				۲۲
				۲۳
				۲۴
				۲۵
				۲۶
				۲۷
				۲۸
				۲۹
				۳۰
				۳۱
				۳۲
				۳۳
				۳۴
				۳۵
				۳۶
				۳۷

۱۹
۲۰
۲۱
۲۲
۲۳
۲۴
۲۵
۲۶
۲۷
۲۸
۲۹
۳۰
۳۱
۳۲
۳۳
۳۴
۳۵
۳۶
۳۷

ספר חובות, ספר שמיטה, ספר פסח, ספר חנוכה, ספר סוכות, ספר שמעון

מספר	שם	מספר	שם	מספר	שם
38	ספר חובות				
39	ספר שמיטה (פסוקים)				
40	ספר שמיטה (פסוקים)				
41	ספר שמיטה (פסוקים)				
42	ספר שמיטה (פסוקים)				
43	ספר פסח				
44	ספר חנוכה				
45	ספר סוכות				
46	ספר שמעון				
47	ספר חובות (פסוקים)				
48	ספר שמיטה (פסוקים)				
49	ספר חנוכה				
50	ספר פסח				
51	ספר שמעון				
52	ספר חובות (פסוקים)				
53	ספר שמיטה (פסוקים)				
54	ספר חנוכה (פסוקים)				
55	ספר סוכות				
56	ספר שמעון				

אדם
עובד

සමුදායක කටයුතු සහතිකය, සහතිකය, සහතිකය සහතිකය, සහතිකය සහතිකය

අංකය	නම	නම	නම	නම
57				සමුදායක කටයුතු සහතිකය
58				සමුදායක කටයුතු සහතිකය (සමුදායක කටයුතු සහතිකය සහතිකය)
59				සමුදායක කටයුතු සහතිකය
60				සමුදායක කටයුතු සහතිකය
61				සමුදායක කටයුතු සහතිකය
62				සමුදායක කටයුතු සහතිකය
63				සමුදායක කටයුතු සහතිකය
64				සමුදායක කටයුතු සහතිකය (500)
65				සමුදායක කටයුතු සහතිකය (500)
66				සමුදායක කටයුතු සහතිකය (500)
67				සමුදායක කටයුතු සහතිකය (1500)
68				සමුදායක කටයුතු සහතිකය (1500)
69				සමුදායක කටයුතු සහතිකය (1500)
70				සමුදායක කටයුතු සහතිකය (5)
71				සමුදායක කටයුතු සහතිකය (5)
72				සමුදායක කටයුතු සහතිකය (5)
73				සමුදායක කටයුතු සහතිකය (500)
74				සමුදායක කටයුතු සහතිකය (500)
75				සමුදායක කටයුතු සහතිකය (500)

සමුදායක කටයුතු සහතිකය

مۆھرىملىك دەۋرىدە ئىشلىتىش، مەبلەغ، مۆلچەرلىك خىراجەت، ئىشلىتىش

مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى
			مۆھرىملىك دەۋرى - مۆھرىملىك دەۋرى (1500 ئىشلىتىش)	76
			مۆھرىملىك دەۋرى - مۆھرىملىك دەۋرى (1500 ئىشلىتىش)	77
			مۆھرىملىك دەۋرى - مۆھرىملىك دەۋرى (1500 ئىشلىتىش)	78
			مۆھرىملىك دەۋرى - مۆھرىملىك دەۋرى (5 خىراجەت ئىشلىتىش)	79
			مۆھرىملىك دەۋرى - مۆھرىملىك دەۋرى (5 خىراجەت ئىشلىتىش)	80
			مۆھرىملىك دەۋرى - مۆھرىملىك دەۋرى (5 خىراجەت ئىشلىتىش)	81
0.00				

5. مۆھرىملىك دەۋرىدە ئىشلىتىش، مۆھرىملىك دەۋرى، مۆھرىملىك دەۋرى

مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى				مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى
			مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى		
			☑			☑	300 ئىشلىتىش	مۆھرىملىك دەۋرى
			☑			☑	01 مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى
						☑	01 مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى
			☑			☑	100 مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى
			☑			☑	300 ئىشلىتىش	مۆھرىملىك دەۋرى
			☑			☑	100 مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى
			☑	☑		☑	05 مۆھرىملىك دەۋرى	مۆھرىملىك دەۋرى
0.00			مۆھرىملىك دەۋرى					

መረጃውን ለማግኘት ለሚያስፈልጉት ሁሉም ደረጃዎች ላይ ይገቡ።

ገጽ 2

አጠቃላይ ስርዓት ለማግኘት ይገቡ።

(5 ደብዳቤ)

ደብዳቤ

2.1 የሚከተሉትን ስራዎች ለማግኘት ይገቡ።

ሰነድ

የሰነድ ስራዎች						
የሰነድ ደረጃ	የሰነድ ዓይነት	የሰነድ ቁጥር	የሰነድ ትኩረት	የሰነድ ስራ	የሰነድ ስራ	የሰነድ ስራ
(የሰነድ ደረጃዎች ለማግኘት ይገቡ።)						
(የሰነድ ዓይነቶች ለማግኘት ይገቡ።)						
(የሰነድ ቁጥሮች ለማግኘት ይገቡ።)						
(የሰነድ ትኩረቶች ለማግኘት ይገቡ።)						
(የሰነድ ስራዎች ለማግኘት ይገቡ።)						
(የሰነድ ስራዎች ለማግኘት ይገቡ።)						
የሰነድ ደረጃ	የሰነድ ዓይነት	የሰነድ ቁጥር	የሰነድ ትኩረት	የሰነድ ስራ	የሰነድ ስራ	የሰነድ ስራ
የሰነድ ደረጃ	የሰነድ ዓይነት	የሰነድ ቁጥር	የሰነድ ትኩረት	የሰነድ ስራ	የሰነድ ስራ	የሰነድ ስራ
የሰነድ ደረጃ	የሰነድ ዓይነት	የሰነድ ቁጥር	የሰነድ ትኩረት	የሰነድ ስራ	የሰነድ ስራ	የሰነድ ስራ
የሰነድ ደረጃ	የሰነድ ዓይነት	የሰነድ ቁጥር	የሰነድ ትኩረት	የሰነድ ስራ	የሰነድ ስራ	የሰነድ ስራ
የሰነድ ደረጃ	የሰነድ ዓይነት	የሰነድ ቁጥር	የሰነድ ትኩረት	የሰነድ ስራ	የሰነድ ስራ	የሰነድ ስራ
የሰነድ ደረጃ	የሰነድ ዓይነት	የሰነድ ቁጥር	የሰነድ ትኩረት	የሰነድ ስራ	የሰነድ ስራ	የሰነድ ስራ

* የሰነድ ስራዎች ለማግኘት ይገቡ።

* የሰነድ ደረጃዎች ለማግኘት ይገቡ።

የሰነድ ስራዎች ለማግኘት ይገቡ።

* የሰነድ ደረጃዎች ለማግኘት ይገቡ።

የሰነድ ስራዎች ለማግኘት ይገቡ።

רבינו						
רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו
רבינו						
רבינו						
רבינו						
רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו
רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו
רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו
רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו	רבינו

* רבינו

2.5 רבינו

רבינו	רבינו
<p>רבינו</p> <ul style="list-style-type: none"> רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו 	<p>2.5.1 רבינו</p> <ul style="list-style-type: none"> רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו
<p>4.2.5 רבינו</p> <ul style="list-style-type: none"> רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו 	<p>2.5.3 רבינו</p> <ul style="list-style-type: none"> רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו רבינו

بۆلۈم 3


سۆزگۈچلەر

(14 نۆمۇر تۈزۈلۈش)

سۆزگۈچلەر

3.1 سۆزگۈچلەر

- سۆزگۈچلەر تۈزۈلۈش.



ክፍል 4

ንግድ ለማስፈጸም የሚያስፈልጉትን ሰነድ ይጠቅሙ

(15 ዓመት ዕድሜ ለሌሎች)

ሰነድ / ሰነድ		1
ሰነድ 1		1.1
ንግድ ለማስፈጸም ሰነድ	ንግድ ለማስፈጸም ሰነድ	
ሰነድ / ሰነድ	ሰነድ / ሰነድ	
ሰነድ 2		1.2
ንግድ ለማስፈጸም ሰነድ	ንግድ ለማስፈጸም ሰነድ	
ሰነድ / ሰነድ	ሰነድ / ሰነድ	
ሰነድ 2		2
ሰነድ 1		2.1
ንግድ ለማስፈጸም ሰነድ	ንግድ ለማስፈጸም ሰነድ	
ሰነድ / ሰነድ	ሰነድ / ሰነድ	
ሰነድ 2		2.2
ንግድ ለማስፈጸም ሰነድ	ንግድ ለማስፈጸም ሰነድ	
ሰነድ / ሰነድ	ሰነድ / ሰነድ	
ሰነድ 3		3
ንግድ ለማስፈጸም ሰነድ	ንግድ ለማስፈጸም ሰነድ	
ሰነድ / ሰነድ	ሰነድ / ሰነድ	

የግድ ሰነድ

ገጽ 5

አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት

(34 ዓመት ስልጠና ስርዓት)

አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት (የሥራ ስልጠና)		1
ሥራ	ሥራ	1.1
አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	1.2
ሥራ	ሥራ	1.3
አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	1.4
አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	1.5
አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	1.6
አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	1.7
አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	አጠቃላይ የሚገኝ የሥራ ስልጠና ስርዓት	1.8

የሥራ ስልጠና

1 حُكْمَرَانِ 7

أَيُّهَا السُّلْطَانُ، أَيُّهَا السُّلْطَانُ، أَيُّهَا السُّلْطَانُ

(12) وَسَرُورَةُ (السُّلْطَانِ)

1- أَيُّهَا السُّلْطَانُ

2- أَيُّهَا السُّلْطَانُ، أَيُّهَا السُّلْطَانُ

سَرُورَةُ

سودانی دہلیزہ نامہ، سہ ماہی، سودانی جی جی جی، اریسٹو

P.O Number (Staff):

سہ ماہی نامہ

O Number (Arrest):

سودانی نامہ

سودانی نامہ اریسٹو سہ ماہی نامہ اریسٹو

31		31 سہ ماہی نامہ 2020		01 سہ ماہی نامہ 2020		سہ ماہی نامہ:		سودانی نامہ:	
سودانی نامہ	سہ ماہی نامہ	سہ ماہی نامہ		سہ ماہی نامہ		سہ ماہی نامہ		سہ ماہی نامہ	سودانی نامہ
		سہ ماہی نامہ	سودانی نامہ	سہ ماہی نامہ	سودانی نامہ	سہ ماہی نامہ	سودانی نامہ		
								01 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								02 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								03 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								04 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								05 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								06 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								07 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								08 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								09 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								10 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								11 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								12 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								13 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								14 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								15 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								16 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								17 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								18 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								19 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								20 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								21 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								22 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								23 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								24 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								25 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								26 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								27 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								28 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								29 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								30 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ
								31 سہ ماہی نامہ 2020	سہ ماہی نامہ

سودانی نامہ

سۆزۈڭىزنىڭ دېھقانچىلىق مەھسۇلاتى، مەھسۇلاتى، سۆزۈڭىزنىڭ قىممىتى، ئىشلىتىش ۋاقتى

2 نۆۋەتلىك 7

ئىشلىتىش ۋاقتى، ئىشلىتىش ۋاقتى، ئىشلىتىش ۋاقتى

(13 نۆۋەتلىك (ر) ئىشلىتىش ۋاقتى)

2- نۆۋەتلىك ئىشلىتىش ۋاقتى (بىر نۆۋەتلىك ۋاقتى)

تېخنىكا سۈپىتى ئىشلىتىش ۋاقتى - 2020										
02 نۆۋەتلىك					01 نۆۋەتلىك					
نۆۋەت	نۆۋەت	نۆۋەت	نۆۋەت	نۆۋەت	نۆۋەت	نۆۋەت	نۆۋەت	نۆۋەت	نۆۋەت	نۆۋەت
1										
2										
3										
4										
5										
6										
7										
8										
9										
10										
11										
12										
13										
14										
15										
16										
17										
18										
19										
20										

تېخنىكا

نۆۋەتلىك ئىشلىتىش ۋاقتى	نۆۋەتلىك ئىشلىتىش ۋاقتى	نۆۋەتلىك ئىشلىتىش ۋاقتى	نۆۋەتلىك ئىشلىتىش ۋاقتى